

Date: 15th February, 2022

To, **BSE Limited**To, **Nat**

Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort,

Mumbai-400001.

Company Scrip Code – 543281

National Stock Exchange of India Limited Exchange Plaza, Plot no. C/1, G Block, Bandra-Kurla Complex, Bandra (W),

Mumbai-400051.

Company Scrip Code – SUVIDHAA

Dear Sir/Madam,

Subject: Submission of Newspaper Publication of Unaudited Financial Results for the quarter

ended on 31st December, 2021 pursuant to regulation 30 & 47 of SEBI (LODR)

Regulations, 2015

With reference to above captioned subject and **Regulation 30 & Regulation 47** of SEBI (Listing Obligation and Disclosures Requirements) Regulations, 2015; please find enclosed herewith the copies of E-Newspaper Advertisement of **Unaudited Financial Results for the quarter ended on 31**st **December, 2021** duly published in "**Financial Express**" (English –National Daily all Editions) and "**Financial Express**" (Gujarati Edition) Newspaper dated **15**th **February, 2022**. The Copy of the said newspaper advertisement is available on the Company's website.

You are kindly requested to acknowledge and update the same into your records.

Thanking you,

Yours faithfully,

For, Suvidhaa Infoserve Limited

PRASHANT THAKAR

Director & CFO (DIN: 03179115)

Total Income

Extraordinary items)

Sheet of the previous year

Date: 14th February, 2021

adani

Capital

Total Income from Operations

Paid up Equity Share Capital

Securities Premium Account

Net Profit / (Loss) for the period

Place: Mumbai

No

9

10

13

16

17

Notes

Net Worth

Debt Equity Ratio

Earnings per equity share Basic (₹) (Not Annualised)

Diluted (₹) (Not Annualised)

Capital Redemption Reserve

Debenture Redemption Reserve Debt Service Coverage Ratio

Interest Service Coverage Ratio

website www.adanicapital.in.

current period/year presentation.

Date: February 14, 2022

Place: Mumbai

operations) -

. Basic

2. Diluted:

Particulars

Net Profit / (Loss) for the period (before Degreciation, Tax, Exceptional and/or

Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)

Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary item

Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items

Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]

Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance

Earnings Per Share (Face value of Rs.1/- each) (for continuing and discontinued

Paid-up equity share capital (Face Value of the share Re. 1/- each)

Standalone

ended or

297.

50.7

6.4

9.4

9.4

9.8

203.3

(0.26

(0.26)

(Unaudited) (Unaudited) (Unaudited

31/12/2021 31/12/2021

76.5

18.2

(16.7)

(16.3)

(16.3)

203.3

(0.08)

Adani Capital Private Limited

Regd Office: Adani House, 56 Shrimali Society, Navrangpura, Ahmedabad - 380009, Gujarat, India | Tel: +91 22 6241 1200 Fax: +91 22 2652 0650 | Website: www.adanicapital.in

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR

THE QUARTER ENDED DECEMBER 31, 2021

The above is an extract of the detailed format of quarterly financial results filed with the stock exchanges under

regulation 52 of the Listing and Other Disclosure Requirements Regulation. The full format of the quarterly

financial results are available on the website of the Stock Exchange www.bseindia.com and on the Company's

For the other line items referred in regulation 52 (4) of the LODR Regulations, pertinent disclosures have been made

The above results were reviewed and recommended by Audit Committee and approved by the Board of Directors at

Figures for the previous periods / year have been regrouped / reclassified wherever necessary to conform with the

to the Stock Exchange(s) (Bombay Stock Exchange) and can be accessed on the URL www.bseindia.com.

CIN: U65990GJ2016PTC093692

Particulars

(before tax, exceptional and / or extraordinary items)

[Comprising of Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]

Net Profit / (Loss) for the period before tax

(after exceptional and / or extraordinary items) Net Profit / (Loss) for the period after tax

(after exceptional and / or extraordinary items)

Total Comprehensive Income for the period

Reserves (Excluding Revaluation Reserves)

Paid up Debt Capital / Outstanding Debt

Outstanding Redeemable Preference Shares

their respective meeting held on February 14, 2022.

The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and www.nseindia.com and on the website of the Company at www.suvidhaa.com

The above Financial Results are reviewed and recommended by the Audit Committee and taken on record by the Board of Directors at their meeting hel-

The exceptional item for the quarter ended 31st December, 2021 and nine months ended 31st December, 2021 is on account of settlement of insurance

(Rupees in million, except per share data and if otherwise stated)

nded or

Unaudited)

88.8

42.0

7.4

7.4

7.4

203.3

0.04

Quarter

ended or

31/12/2020

175.0

49.1

3.8

3.8

3.8

3.8

203.3

0.02

0.02

Quarter Ended

31/12/2021

(Unaudited)

597.75

12.08

12.08

10.58

10.23

173.00

265.57

3.128.76

3,567.33

3.70

0.61

0.61

NA

NA

NΑ

Consolidated

31/12/2021 31/12/2021 31/12/2020

948.9

63.0

15.2

18.2

18.2

18.6

203.3

(0.20)

(0.20)

For, Suvidhaa Infoserve Limited

Naresh Sharma

(Rs in millions)

1,907.36

201.23

201.23

162.77

162.54

173.00

200.57

3,128.76

3,502.33

9,800.76

2.80

9.41

9.40

NA

NA

NA

Mr. Gaurav Gupta MD & CEO

DIN: 01669109

Year Ended

31/03/2021

(Audited)

Managing Director

Unaudited) (Unaudite

192.7

66.0

20.7

20.7

20.7

20.7

203.3

0.10

0.10

SUVIDHAA INFOSERVE LIMITED

(CIN: L72900GJ2007PLC109642)

Registered Office: Unit No 02, 28th Floor, GIFT-II Building, Block No. 56, Road-5C, Zone-5, Gift City Gandhinagar 382355

Corporate Office: 14, Olympus Industrial Estate, Off Mahakali Caves Road, Andheri (East), Mumbai 400093

Tel.: + 91 9223225225 E-mail: cs@suvidhaa.com Website: www.suvidhaa.com

EXTRACT OF STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL

RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2021

એસકે ફાઈનાન્સ લિમિટેડ (જુનું નામ – એસ કે ફીનકોર્પ લિમિટેડ)

રજીસ્ટર્ડ ઓફીસ : જી ૧, જી ૨, ન્યુ માર્કેટ, ખસા કોઠી સર્કલ, જયપુર, રાજસ્થાન

સ્થાવર મિલકતના સાંકેતિક કબજા અંગેની નોટિસ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના રૂલ ૮(૧) હેઠળ નોટીસ

ખાથી નીચે સહી કરનાર **એસકે ફાઈનાન્સ લિમિટેડ,** જેની રજીસ્ટર્ડ ઓફીસ : જી ૧−૨, ન્યુ માર્કેટ, ખસા કોઠી, જયપુર–૩૦૨૦૦૧ ના અધિકૃત અધિકારીશ્રીને સિક્યુરીટાઈઝેશન એન્ડે રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ બેક્ટ, ૨૦૦૨ (પર્ષ ઓફ ૨૦૦૨) અને **કેલમ ૧૩(૧૨)** ની મળેલ સત્તાની રૂએ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ ના **રૂલ ૩** અને ઉપરોક્ત કાયદાની **કલમ ૧૩(૨)** સાથે વાંચતા **તા. ૨૫.૧૧.૨૦૨૧** ના રોજ ડિમાન્ડ નોટીસ આપીને ઉધારકર્તાઓ **દિલીપ સિંઘ રાવ** તે મગનસિંઘ લુન્ડાસરા ના પુત્ર (કર્જદાર), રહે. સી/૪७, સદ્ગુરૂ ટેનામેન્ટ બંગલોઝ વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસે, સીટીએમ, અમદાવાદ, ગુજરાત–૩૮૦૦૨૬ અને ઓફીસ દુકાન નં. ૧૫, શ્રીનંદ સીટી બ્લોક–બી, ઘંટાકર્ણ માર્કેટ, રામોલ રોડ, સીટીએમ, અમદાવાદ -ગુજરાત–૩૮૦૦૨૬ **અન્ય** સહ–કર્જદાર **જયંતા <u>કુંવર તે</u> દિલીપ સિંઘ લુન્કાસરા ના પત્ની**, રહે. સી/૪७, સદ્ગુરૂ ટેનામેન્ટ બંગલોઝ, વડોદરા એક્સપ્રેસ હાઈવે પાસે, સીટીએમ લેન્ડમાર્ક : બરોડા એક્સપ્રેસ હાઈવે પાસે, અમદાવાદ, ગુજરાત–૩૮૦૦૨૬ ને નોટીસમ જણાવેલ બાકી રકમ **રૂા. ૨૯,૦૨,૮૧૧/- (રૂા. ઓગણત્રીસ લાખ બે હજાર આઠ**સે **અગિયાર પૂરા)** આ નોટીસ મળ્યાના ૬૦ દિવસમાં પરત ચુકવવા જણાવ્યું હતું.

આથી ઉદ્યારકર્તા સદર રકમ બેંકને પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા हોવાથી ઉદ્યારકર્તા તેમજ જાઠેર જનતાને નોટીસ આપીને જાગાવવામાં આવે છે કે આથી નીરો સઠી કરનારે નીરે જણાવેલ મિલકતનો ઉપર જણાવેલ **કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ(૪) અને સિક્યરીટી** ઈન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ ના રૂલ ૮ સાથે વાંચતા તેઓને મળેલ સત્તાની રૂએ તા. ૧૨.૦૨.૨૦૨૧ ના રોજ સાંકેતિક કબજો લઈ લીધો છે.

આથી ઉદ્યારકર્તા તેમજ જાહેર જનતાને આથી ચેતવણી આપી જણાવવામાં આવે છે કે તેઓ સદર મિલકત અંગે કોઈપણ વ્યવહાર ના કરે અને તેમ છતાં પણ કોઈ તેમ કરશે તો તેઓ એસકે ફાઈનાન્સ લિમિટેડ પાસેથી લીધેલ રૂા. ૨૯,૦૨,૮૧૧/- (રૂા. ઓગણત્રીસ લાખ બે **હજાર આઠસો અગિયાર પૂરા)** તેમજ તેના ઉપરના વ્યાજ સહિતની રકમ બેંકને ચૂકવવા સાર્

ઉધારકર્તાઓને ખાસ ધ્યાન દોરવાનું કે સરફેસી કાયદાની કલમ ૧૩ (૮) ની જોગવાઈ અનુસાર આપેલ સમયમર્યાદામાં કાયદાનુસાર તેમની સલામત મિલકત પાછી મેળવી શકે છે.

સ્થાવર મિલકતનું વર્ણન

રહેણાંક મિલકતનો ખંડ કે ભાગ બધુંજ, જેનો યુનિટ નં. ૪७, સદ્ગુરૂ કો–ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની સદ્ગુરૂ ટેનામેન્ટ / બંગ્લોઝ નામની સ્કીમમાં, રામોલ તાલુકો વટવા, જીદ્યો અમદાવાદ જે જમીનનો સર્વે નં. ૫૬૪, ૫૬७ અને ૫૯७, ટી.પી. સ્કીમ નં. ૧૦७ (પ્રપોઝ્ડ), ફાઈનલ નં. ૩૦ અને ૩૩+૬૨, ૨જીસ્ટ્રેશન સબ–ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ અમદાવાદ–૧૧(અસલાલી), ક્ષેત્રફળ ૪૦.૯૭ ચો.મી.વાળી જયંતાકુંવર દિલીપર્સિંઘ લુન્ડાસરાની માલિકીની મિલકત. જેની આજુબાજુ : ઉત્તરમાં યુનિટ નં. ૪૬; દક્ષિણમાં યુનિટ નં. ૪૮; પૂર્વમાં યુનિટ નં. ૫૪, પશ્ચિમમાં આંતરીક રોડ.

અધિકૃત અધિકારી તા. ૧૨.૦૨.૨૦૨૨ એસકે ફાઈનાન્સ લિમિટેડ એસકે કાઈનાન્સ લિમિટેડ

SK (જુનું નામ – એસ કે ફીનકોર્પ લિમિટેડ) રજીસ્ટર્ડ ઓફીસ : જી ૧, જી ૨, ન્યુ માર્કેટ, ખસા કોઠી સર્કલ, જયપુર, રાજસ્થાન

સ્થાવર મિલકતના સાંકેતિક કબજા અંગેની નોટિસ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના રૂલ ૮(૧) હેઠળ નોટીસ

આથી નીચે સહી કરનાર **એસકે ફાઈનાન્સ લિમિટેડ,** જેની રજીસ્ટર્ડ ઓફીસ : જી ૧–૨, ન્યુ માર્કેટ, ખસા કોઠી, જયપુર-30૨00૧ ના અધિકૃત અધિકારીશ્રીને સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૫૪ ઓફ ૨૦૦૨) અને <mark>કલમ ૧૩(૧૨)</mark> ની મળેલ સત્તાની રૂએ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ ના રૂલ 3 અને ઉપરોક્ત કાયદાની કલમ ૧૩(૨) સાથે વાંચતા **તો. ૧૨.૦૩.૨૦૨૧** ના રોજ ડિમાન્ડ નોટીસ આપીને ઉઘારકર્તાઓ **બિન્દી વિરેશ શાહ, લોન એકાઉન્ટ નં. ૫૩૨૦૨૭૧,** રહે. પ્રેરણા વિરાજ ટાવર–૧, સોમેશ્વરા ભાગ–૨ પાછળ, સેટેલાઈટ, અમદાવાદ. લેન્કમાર્ક : સોમેશ્વરા ભાગ–૨, અમદાવાદ–૩૮૦૦૧૫. **અન્ય** સહ–કર્જદાર **વિરેશ ઈન્દ્રકાંત શાહ,** રહે. પ્રેરણા વિરાજ ટાવર–૧, સોમેશ્વરા ભાગ–૨ પાછળ,

પંચાવન પૂરા) આ નોટીસ મળ્યાના ૬૦ દિવસમાં પરત ચુકવવા જણાવ્યું હતું. આથી ઉદ્યારકર્તા સદર રકમ બેંકને પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી ઉદ્યારકર્તા તેમજ જાહેર જનતાને નોટીસ આપીને જણાવવામાં આવે છે કે અથી નીચે સહી કરનારે નીચે જણાવેલ મિલકતનો ઉપર જણાવેલ **કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ(૪) અને સિક્યરી**ટી ઈન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ ના રૂલ ૮ સાથે વાંચતા તેઓને મળેલ સત્તાની રૂએ તા. ૧૨.૦૨.૨૦૨૨ ના રોજ સાંકેતિક કબજો લઈ લીધો છે.

સેટેલાઈટ, અમદાવાદ. લેન્ડમાર્ક : સોમેશ્વરા ભાગ-૨, અમદાવાદ-૩૮૦૦૧૫ ને નોટીસમાં

જણાવેલ બાકી રકમ <mark>રૂા. ૨૦,૮૧,૫૫૫/- (રૂા. વીસ લાખ એક્ચાસી ફજાર પાંચસો</mark>

આથી ઉઘારકર્તા તેમજ જાહેર જનતાને આથી ચેતવણી આપી જણાવવામાં આવે છે કે તેઓ સદર મિલકત અંગે કોઈપણ વ્યવહાર ના કરે અને તેમ છતાં પણ કોઈ તેમ કરશે તો તેઓ એસકે ફાઈનાન્સ લિમિટેડ પાસેથી લીઘેલ રૂા. ૨૦,૮૧,૫૫૫/- (રૂા. વીસ લાખ એક્ચાસી **હજાર પાંચસો પંચાવન પૂરા)** તેમજ તેના ઉપરના વ્યાજ સહિતની રકમ બેંકને ચૂકવવા સારૂ બંધનકર્તા રહેશે.

ઉદ્યારકર્તાઓને ખાસ ધ્યાન દોરવાનું કે સરફેસી કાયદાની કલમ ૧૩ (૮) ની જોગવાઈ અનુસાર આપેલ સમયમર્ચાદામાં કાયદાનુસાર તેમની સલામત મિલકત પાછી મેળવી શકે છે.

સ્થાવર મિલકતનું વર્ણન

ઘંઘાકીય મિલકતનો ખંડ કે ભાગ બધુંજ, ગીતસુઘા ઓનર્સ એસોસિએશનની ગીતસુધા એપાર્ટમેન્ટ નામે ઓળખાતી સ્કીમના ફલેટ નં. ૨ ની માર્જીનની જગ્યા ઉપર બંધાચેલ ક્ષેત્રફળ આશરે 30.0૪ ચો.મી. વાળી ગ્રાઉન્ડ ફલોર ઉપરની દુકાન નં. ૨/૧, જેનો જમીન સર્વેનં. ૩૬૮/૨, ફાઈનલ પ્લોટ નં. ૪૫૫, ટાઉન પ્લોનીંગ સ્કીમ નં. ૧/બી, મોજે બોડકદેવ, તાલુકો ઘાટલોડીયા, જીદ્યો અમદાવાદ, ૨જીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-3(મેમનગર), જેનો રજીસ્ટ્રેશન નં. ૫૫૫૧ તા. ૦૮.૦૬.૨૦૧૮. જેની આજુબાજુ : ઉત્તરમાં રોડ; દક્ષિણમાં કોમન પેસેજ અને સીડી; પૂર્વમાં ફ્લેટ નં. ૨, પશ્ચિમમાં ફ્લેટ નં. ૧.

તા. ૧૨.૦૨.૨૦૨૨ અધિકૃત અધિકારી એસકે ફાઈનાન્સ લિમિટેડ

HARTERED I **LOGISTICS I**

CHARTERED HOUSE, 6, DADA ESTATE, SARKHEJ-SANAND CHOKDI, SARKHEJ, AHMEDABAD-382210 Website: www.chartered.co.in, Email: cs@chartered.co.in, Tel.: 079 26891752 CIN No. L74140GJ1995PLC026351 Standalone Unaudited Financial Results for the Quarter & Half Voar Ended 31st December 202

	Standalone onaudited i mai						(Rs. In Lakhs)	
		For	For the Quarter Ended			Nine Month Ended		
SI	Particulars	31-12-2021	30-09-2021	31-12-2020	31-12-2021	31-12-2020	31-03-2021	
No.	T di libulato	Un audited	Un audited	Un audited	Un audited	Un audited	Audited	
1	Total income from Operations	3121.62	3327.44	3823.95	9430.90	9210.26	13149.26	
2	Net Profit/(Loss) for the period (before Tax,	10.41	10.97	26.18	23.71	(88.12)	(238.87)	
	Exceptional and/or Extraordinary items)	ı	<u> </u>					
3	Net Profit/(Loss) for the period before Tax (after	10.41	10.97	26.18	23.71	(88.12)	(238.87)	
	Exceptional and/or Extraordinary items)		į J					
4	Net Profit / (Loss) for the period after tax (after	10.41	10.97	26.18	23.71	(88.12)	(236.63)	
L	Exceptional and/or Extraordinary items)	ı	<u> </u>					
5	Total Comprehensive Income for the period	10.41	10.97	26.18	23.71	(88.12)	(222.63)	
ı	[Comprising Profit/(Loss) for the period (after tax)		į Į					
L	and Other Comprehensive Income (after tax)]	ı	į J					
6	Equity Share Capital (F.V. Re. 1/- per share)	993.40	993.40	993.40	993.40	993.40	993.40	
7	Reserves (excluding Revaluation Reserve) as shown	-	- 1	-	-	-	-	
	in the Audited Balance Sheet of the previous year		į J					
8	Earnings Per Share (of Rs.1/- each) (for continuing							
ı	and discontinued operations)	ı	<u> </u>					
ı	Basic:	0.01	0.01	0.03	0.02	(0.09)	(0.22)	

Note: 1. The above is an extract of the detailed format of Standalone unaudited Financial Results for the Quarter/Financial Year ended 31.12.2021 filed with the Stock Exchanges unde Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of said Standalone unaudited Financial Results is available on Stock Exchangi ebsite www.bseindia.com and on Company's website www.chartered.co.in. 2. The results of quarter and half year ended 31st December 2021 were reviewed by Audit committee an approved by Board of Directors on its meeting held on 12-02-2022, they have subjected to limited review by the statutory auditor. The unaudited results are prepared in accordance wit ne Indian Accounting Standards (Ind-As)

0.01

0.01

For and on behalf of the Board of Directors o **Chartered Logistics Limited**

Lalit Kumar Gandh (Managing Director) DIN: 00618427

0.02

Place: Ahmedabad

Date: 12-11-2021

Patels Airtemp (India) Limited

0.03

Registered Office: 5th Floor, Kalpana Complex, Near Memnagar Fire Station Navrangpura, Ahmedabad - 380009 CIN: L29190GJ1992PLC017801 E-mail: share@patelsairtemp.com Phone: +91-2764286634/35 Fax: +91-2764286301, Website: www.patelairtemp.com

Extract of Unaudited Standalone & Consolidated Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2021 (Rs. in Lakhs except EPS) Standalone Consolidated

Ji.			Stallualvill	,		GuiiSuiiuateu	
No.	Particulars	Quarter ended	Quarter ended	Nine Months ended	Quarter ended	Quarter ended	Nine Months ended
		31-12-2021	31-12-2020	31-12-2021	31-12-2021	31-12-2020	31-12-2021
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited
1	Total Income from operations	11,322.37	8,313.06	22,292.56	11,322.37	8,313.06	22,292.56
2	Other Income	15.76	16.22	51.74	15.76	16.22	51.74
3	Total Income (1+2)	11,338.13	8,329.28	22,344.30	11,338.13	8,329.28	22,344.30
4	Profit before Exceptional Items and Tax	531.83	444.34	1,234.07	531.83	444.34	1,232.35
5	Profit before Tax	531.83	444.34	1,234.07	531.83	444.34	1,232.35
6	Net Profit for the period	395.03	332.50	916.79	395.03	332.50	915.07
7	Total Comprehensive income for the period	391.56	332.00	906.36	391.56	332.00	904.64
8	"Paid-up Equity Share Capital						
	(Face value of Rs. 10/- each per Share)"	507.02	507.02	507.02	507.02	507.02	507.02
9	Earnings Per Share (EPS) of Rs. 10/- each						
	(Not Annualised)						
	1. Basic (Rs.)	7.79	6.56	18.08	7.79	6.56	18.05
	2. Diluted (Rs.)	7.79	6.56	18.08	7.79	6.56	18.05

Notes:

- The above Unaudited Standalone & Consolidated financial results for the Quarter and Nine Months ended 31st December, 2021 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on 14th February, 2022 and the Limied Review of the same has been carried out by the Statutory Auditors of the Company.
- 2 The unaudited Consolidated Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2021 comprises of Unaudited Financial Results of M/s. Patels Airtemp (India) Limited and management certified Financial Results of M/s. Patels Airtemp (USA) Inc., a wholly owned subsidiary (WOS) of the Company.
- The above is an extract of the detailed format of Standalone & Consolidated Unaudited Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2021 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone & Consolidated Unaudited Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2021 are available on the Stock Exchange website: www.bseindia.com and on the Company's website: www.patelsairtemp.com

For and on behalf of the Board For Patels Airtemp (India) Limited Sd/-

Sanjivkumar N. Patel (Managing Director) (DIN: 02794095)

હોમ ફર્સ્ટ ફાયનાન્સ કંપની ઈન્ડિયા લિમીટેડ,

CIN:U65990MH2010PTC240703

Website: homefirstindia.com, Phone No.: 180030008425, Email ID: loanfirst@homefirstindia.com

Place: Rakanpur, Dist: Gandhinagar

Date: 14th February, 2022

જંગમ મીલકતનું વેચાણ (ઈન્વેન્ટરી)

સિકચોરિટીઝેશન અને રિકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્શિયલ એસ્ટટ અને એન્ફોર્સમેન્ટ ઓફ ઈન્ફોર્સમેન્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ જંગમ અસ્ક્રચામતોના વેચાણ માટે ઈ-ઓક્શન વેચાણ નોટિસ સુરક્ષા વ્યાજ (અમલ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૬)

આથી સામાન્ય રીતે અને ખાસ કરીને ઉદ્યાર લેનારા(ઓ) અને સહ-કરજદાર(રો) કોલમ(ર) મુજબ નોટીસ આપવામાં આવે છે કે નીચે જણાવેલ સ્થાવર મિલકતોનું વર્ણન કોલમ(3) મુજબ સુરક્ષિત લેણદારો પાસે ગીરો/ચાર્જ, જેનો ભૌતિક કબજો **હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની ઇન્ડિયા લિમિટેડ**ના અધિકારી દ્વારા તેના લેણાં અને વ્યાજની નીચે વિગત મુજબની વસુલાત માટે લેવામાં આવ્યો છે અને બાકી ચૂકવણી કરવામાં નિષ્ફળતાના પરિણામે નીચે સહી કરનાર કથિત કાચદાના સેકશન ૧૩(૧૨) હેઠળ જણાવેલ મિલકત/સંપતિ અને મિલકતમાં પડેલ માલ/જંગમ/વ્યક્તિગત મિલકતના વેચાણ દ્વારા લેણાંની વસૂલાતનો પ્રસ્તાવ છે અને તે વેચવામાં આવશે "જેમ છે ત્યાં છે", "જે છે તે છે", અને "જે પવ છે" નીચે જણાવ્યા મુજબ **હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપની ઈન્ડિયા લિમિટેડ**ના લીધે કલમ (૧) મુજબ ઉધાર લેનારા(રો) અને સહ-કરજદાર(રો) પાસેથી બાકી રકમની વસૂલાન માટે "ઓનલાઈન" હારાજી હાથ ધરવામાં આવશે, **બીડ વધારાની રકમ રૂા. ૧૦૦૦/– છે.**

નં. અ.	કરજદાર (રો) અને સહકરજદાર (રો) ના નમ	મિલકતની વિગત	સામગ્રીની યાદીઓ	માંગણા નોટીસની તારીખ	માંગણા નોટીસની તારીખ બાકી કુલ (રૂા.) માં	કબજો લીધાની તારીખ	રીર્ઝવ કિંમત (રૂા.) માં	ઇમેડી (રૂા₊) માં	વારીમ અને સમય ઇ-હરાજીની	ઈએમડી અને દસ્તાવેજ જમા કરાવવાની છેલ્લી તારીખ અને સમય	
۹		મોજે સાચણ, તા. ઓલપાડ, જી. સુરત ગુજરાત - ૩૯૪૧૩૦.	સોફા, ટથુળલાઈટ, લેમ્પ, પંખા, ટેલીવિઝન અને સેટઅપ બોક્ષ, મિરર, ઝુમર, કપ બોર્ડ, લાકડાનું ટેબલ, પ્લાસ્ટીક ટબ, રેફ્રિજરેટર, ગેસ સ્ટવ, ગેસ સીલીન્ડર, વોટર ફીલ્ટર, ક્રિચન વેર, બકેટ, ખુરશી, સાથકલ, પલંગ.	૦૪ જુલાઇ ૨૦૨૧	૧૧,૪૬,૧૨૫	૦૮-સપ્ટે૨૦૨૧	36,ξζο	3,68८	૨૩-૦૨-૨૦૨૨ (સવારે ૧૧ થી બપોરે ૨)	૨૧-૦૨-૨૦૨૨ (સવારે ૧૧ થી બપોરે ૨)	<i>e</i> ६६४६० e ६४e

નિયમો અને શરતો : ઇ-હુરાજુ "જ્યાં છે જેમ છે અને જે છે તે છે" અધારે ચોજાશે અને "ઓનલાઇન" કરવામાં આવશે. ઓનલાઇન ઈ-હરાજી અંગેના બીડ ફોર્મ, ડેક્લેરેશન, ઈ-હરાજીના સામાન્ચ નિચમો અને શરતો ધરાવતા ઈ-હરાજી ટેન્ડર દસ્તાવેજ પોર્ટલની સાઈટ પર ઉપલબ્ધ છે.

અધિકૃત અધિકારીની શ્રેષ્ઠતમ જાણકારી મુજબ કોઈ પણ મિલકત પર કોઈ ભારણ નથી. તેમ છતાં, ઈચ્છુક બીડરોએ તેમનું બીડ જમા કરાવતા પહેલાં ભારણ, હરાજીમાં મૂકેલ મિલકત/તોનું ટાઈટલ, મિલકતને અસર કરતા દાવા/અધિકાર/બાકીલેણાં અંગે સ્વતંત્ર રીતે તપાસ કરાવી લેવી. ઈ-હરાજીની જાહેરાત **હોમ ફર્સ્ટ**નું કોઈ પ્રતિનિધિત્વ કે તૂનું કોઈ વચન આપવા બંધાચેલ નથી કે બંધાશે નહીં. મિલકતનું વેચાણ તેની પરના હાલના તેમજ ભવિષ્યના તમામ કરબોજ ભલે તે **હોમ ફર્સ્ટ**ને જાણ્યા-અજાણ્યા હોય તે તમામની સાથે થશે. અધિકૃત અધિકારી/સિક્ચોર્ડ લેણદાર ક્યારેય અને કોઈ પણ રીતે ત્રીજા પક્ષના દાવા/અધિકારી/બાકીલેણા અંગ

વેચાણ સિક્યુરિટાઈપ્રેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ડ્રોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ દર્શાવેલ નિચમો/શરતોને આધીન થશે. ઈ-હરાજીના અન્ય નિચમો અને શરતો નીચેની વેબસાઈટ્સ પર પ્રકાશિત થચેલ છે.

01. http://www.homefirstindia.com, 02. https://homefirst.auctiontiger.net

સરફેસી એક્ટ ૨૦૦૨ના નિયમ હેઠળ વિધીવત વેચાણ નોટિસ

દેવાદારો/જામીનદારોનું અ્ નોટિસ્ મારફ્તે ઉપર્1ક્ત જણાવેલ બાકી લેણાંની રકમ તથા ચડત વ્યાજ અને આનુષંગીક ખર્ચાઓ સાથે જાહેર હરાજીની તારીખ પહેલા ચૂકવવા જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં નિષ્ફળ જશે તો ઉપરોક્ત મિલકતોની જાહેર હરાજી/વેચાણ કરી બાકી રહેતી રકમ વ્યાજ અને ખર્ચાઓ સાથે વસૂલાત કરવા કાનૂની રાહે પગલાં લેવામાં આવશે.

તારીખ : ૧૫.૦૨.૨૦૨૨, સ્થળ : સુરત.

સહી/- અધિકૃત અધિકારી, હોમ ફર્સ્ટ ફાચનાન્સ કંપની ઇન્ડિયા લિમીટેડ

(Rs. in Lakhs)

SUVIDHAA INFOSERVE LIMITED

(CIN: L72900GJ2007PLC109642)

Registered Office: Unit No 02, 28th Floor, GIFT-II Building, Block No. 56, Road-5C, Zone-5, Gift City Gandhinagar 382355 Corporate Office: 14, Olympus Industrial Estate, Off Mahakali Caves Road, Andheri (East), Mumbai 400093 Tel.: + 91 9223225225 E-mail: cs@suvidhaa.com Website: www.suvidhaa.com

EXTRACT OF STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31^{5T} DECEMBER, 2021

Sr.	Particulars		Standalone		Consolidated			
No.		Quarter ended on	Nine Month ended on	Quarter ended on	Quarter ended on	Nine Month ended on	Quarter ended on	
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	
	and the second s	31/12/2021	31/12/2021	31/12/2020	31/12/2021	31/12/2021	31/12/2020	
1	Total Income	76.5	297.5	175.0	88.8	948.9	192.7	
2	Net Profit / (Loss) for the period (before Depreciation, Tax, Exceptional and/or Extraordinary items)	18.2	50.7	49.1	42.0	63.0	66.0	
3	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(16.7)	6.4	3,8	7.1	15.2	20.7	
4	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(16.3)	9.4	3.8	7.4	18.2	20.7	
5	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(16.3)	9.4	3.8	7.4	18.2	20.7	
6	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(16.3)	9.8	3.8	7.4	18.6	20.7	
7	Paid-up equity share capital (Face Value of the share Re. 1/- each)	203.3	203.3	203.3	203.3	203.3	203.3	
8	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	*		*				
9	Earnings Per Share (Face value of Rs.1/- each) (for continuing and discontinued operations) -	10.00	(0.00)					
	1. Basic: 2. Diluted:	(80.0)	(0.26)	0.02	0.04	(0.20)	0.10	

- The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and www.nseindia.com and on the website of the Company at www.suvidhaa.com
- The above Financial Results are reviewed and recommended by the Audit Committee and taken on record by the Board of Directors at their meeting held
- The exceptional item for the quarter ended 31" December, 2021 and nine months ended 31" December, 2021 is on account of settlement of insurance For, Suvidhaa Infoserve Limited

Date: 14th February, 2021 Naresh Sharma

Place: Mumbai **Managing Director**



EXTRACT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2021 (Unaudited)

				Conso	lidated		
Sr.	Particulars		Quarter Ended	d	Nine N	lonths	Year Ended
No.	r ai ucuiai s	31-12-2021	30-09-2021	31-12-2020	31-12-2021	31-12-2020	31-03-2021
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income From Operations	4,400.44	4,478.00	3,990.02	12,753.38	11,431.23	17,913.66
2	Net Profit / (Loss) before Tax	49.33	49.19	236.18	191.76	867.57	1,243.37
3	Net Profit / (Loss) after Tax	38.13	33.93	177.56	140.28	645.95	904.57
4	Total Comprehensive Income for the Period (Comprising of Profit After Tax and Other Comprehensive Income After Tax)	197.38	43.36	180.65	318.37	663.85	925.82
5	Paid-up equity share capital	1,007.58	1,007.58	1,007.58	1,007.58	1,007.58	1,007.58
6	Reserves (Excluding Revaluation Reserves & Government Grant)	5,496.72	5,299.33	4,956.68	5,496.72	4,956.68	5,198.50
7	Earnings Per Share (EPS) not annulized (FV. Rs. 2/- each)						
	Basic & Diluted (in Rs.)	0.39	0.09	0.36	0.63	1.32	1.84
	See accomplying note to the Financial Results						

Note: (1) The above Unaudited Consolidated Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 14th February, 2022. The statutory auditors of the company have carried out limited review of the financial results for the nine months and quarter ended 31st December, 2021.(2) The Above Financial Results have been prepared in accordance with the applicable Indian Accounting Standards as prescribed u/s. 133 of the Companies Act, 2013 read with rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended and other recognized accounting practices and policies to the extent applicable.

(3) Standalone Financial Results as on 31st December, 2020 are as under :

(₹ in Lakhs)

		Standalone								
Sr.	Particulars		Quarter Ended	d	Nine N	Year Ended				
No.	raticulais	31-12-2021	30-09-2021	31-12-2020	31-12-2021	31-12-2020	31-03-2021			
		Unaudited	Unaudited	Unaudited	Unaudited		Audited			
1	Total Income From Operations	4,400.44	4,478.00	3,990.02	12,753.38	11,431.23	17,913.66			
2	Net Profit / (Loss) before Tax	49.33	49.19	236.18	191.76	867.57	1,243.37			
3	Net Profit / (Loss) after Tax	38.13	33.93	177.56	140.28	645.95	904.57			
4	Total Comprehensive Income for the Period (Comprising of Profit After Tax and Other Comprehensive Income After Tax)	38.40	32.16	178.55	145.47	658.02	913.61			

(4) The above is an extract of the detailed format of unaudited financial results for the quarter and nine months ended 31st December, 2021 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited financial results for the guarter and nine months ended 31st December, 2021 are available on the Company's website at www.captainpolyplast.com and on the website of the Stock Exchange at www.bseindia.com. (5) Previous periods / years' figures have been re-grouped / re-classified, where necessary to make it comparable with the current period.

> For, CAPTAIN POLYPLAST LTD Sd/-

Ramesh D. Khichadia (Managing Director) (DIN - 00087859)

CAPTAIN POLYPLAST LTD.

e-mail: info@captainpolyplast.in | web: www.captainpolyplast.com | CIN NO.: L25209GJ1997PLC031985

RCI INDUSTRIES & TECHNOLOGIES LIMITED

Regd. Off.: Unit No. 421, 4th Floor, Pearl Omaxe, Netaji Subhash Place, Pitampura Delhi-110034 CIN No.: L74900DL1992PLC047055, Phone: 011-41681824, Email:compliance@rciind.com Website: www.rciind.com

EXTRACT OF UN-AUDITED STANDALONE & CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 3187 DECEMBER, 2021

	N .	8		Standalo	ne		4		ated		
SI No		Quarter Ended			Nine Months Ended		Quarter Ended			Nine Months Ended	Year ended
APR.		31.12.2021 Unaudited	30.09.2021 Unaudited	31.12.2020 Unaudited	10.75	11532 NOSSER 100	31.12.2021 Unaudited		31.12.2020 Unaudited	31.12.2021 Unaudited	31.03.2021 Audited
1	Total Income from operations	1,335.76	1,253.57	1,777.03	5,043.72	6,880.22	1,335.76	1,253.58	1,773.82	5,043.72	7,079.95
2	Net Profit/ (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	(1,265.66)	(2,233.05)	(893.15)	(3,851.36)	(9,224.97)	(1,267.28)	(2,233.05)	(2,678.88)	(3,853.62)	(15,865.69)
3	Net Profit/ Loss for the period before tax (after exceptional and/or extraordinary items)	(1,265.66)	(2,233.05)	(893.15)	(3,851.36)	(9,224.97)	(1,267.28)	(2,233.05)	(2,678.88)	(3,853.62)	(15,865.69)
4	Net Profit for the period after tax (after exceptional and/or extraordinary items)	(1,244.17)	(2,272.56)	(898.13)	(3,842.60)	(9,054.60)	(1,245.79)	(2,272.55)	(2,683.85)	(3,844.86)	(15,695.32)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	(1,241.38)	(2,269.76)	(896.27)	(3,834.21)	(9,043.41)	(1,241.14)	(2,270.38)	(2,723.94)	(3,844.86)	(15,878.58)
6	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10/- each)	1,567.64	1,567.64	1,567.64	1,567.64	1,567.64	1,567.64	1,567.64	1,567.64	1,567.64	1,567.64
7	Earnings per Share(of Re 1/- each) for continuing and										9
	discontinued operations)- (a) Basic (b) Diluted	(7.94) (7.94)	(14.50) (14.50)	(5.73) (5.73)	(24.51) (24.51)	(57.76) (57.76)	28803	(14.50) (14.50)	(17.12) (17.12)	(24.53) (24.53)	

- 1 The above is an extract of the detailed format of Un-Audited Standalone & Consolidated Financial Results for the quarter and Nine Months ended 31st December, 2021 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-Audited Financial Result for the quarter and Nine Months ended 31st December, 2021 are available on the websites of the Stock Exchange; www.bseindia.com and on the Company's website; www.rciind.com.
- 2. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on 14th February, 2022. 3. During the year ended March 31, 2020, all the lenders to Company has declared the account as non performing assets (NPA) due to non payment of interest due and borrowed amount. The parent company restructuring plan is under consideration of the consortium lenders and as proposed by the company, partial infudion of fund amounting to Rs. 16.5 crore has been made in

financial year ended March 31, 2021. Figures for the previous period have been re-grouped/rearranged/restated wherever necessary to make them comparable with those of the current period.

For and on behalf of the Board of Directors

FOR RCI Industries and Technologies Limited Rajeev Gupta

Managing Director

DIN -00503196

Date: 14.02.2022 Place: New Delhi

WINRO COMMERCIAL (INDIA) LIMITED

CIN: L51226MH1983PLC165499

Statement of Unaudited Standalone & Consolidated Financial Results for the Quarter and Nine months ended December 31, 2021

Regd. Office: 209-210, Arcadia Building, 195, Nariman Point, Mumbai - 400 021 Tel.: 022-40198600, Fax: 022-40198650; Website: www.winrocommercial.com; Email: winro.investor@gcvl.in

Sr.			Standalon	ле		Consolidated			
No.	Particulars	Particulars Quarter Ended Nine Months Ended			Quart	ter Ended	Nine Months Ended		
		Dec 31, 2021	Dec 31, 2020	Dec 31, 2021	Dec 31, 2021	Dec 31, 2020	Dec 31, 2021		
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)		
1)	Total Income	169.42	2,826.13	3,122.30	169.42	2,826.13	3,122.30		
2)	Net Profit before tax #	25.40	2,725.04	2,769.88	25.40	2,725.04	2,769.88		
3)	Net profit / (loss) after tax #*	26.20	2,035.52	2,022.00	(176.90)	3,897.85	4,510.35		
4)	Total Comprehensive income {Comprising net profit / (loss) (after tax) and Other Comprehensive Income (after tax)}*	3,465.95	6,526.27	14,729.86	3,171.00	11,992.43	22,126.97		
5)	Equity Share Capital (Face value of Rs 10/- each)	125.25	125.25	125.25	125.25	125.25	125.25		
6)	Earning per Share (of Rs 10/- each) (a) Basic (not annualised)	2.09	162.51	161.43	(14.12)	311.20	360.10		
	(b) Diluted (not annualised)	2.09	VC-000000000000000000000000000000000000	161.43	(14.12)	311.20	360.10		

The Company does not have Exceptional / Extraordinary items to report for the above periods.

 The above figures for consolidated financial results includes share of net profit/(loss) and share of other comprehensive income in Associates accounted for using equity method.

- 1) The above unaudited financial results for the quarter and nine months ended December 31, 2021 have been reviewed by the Audit committee and on its recommendation, have been approved by the Board of Directors at its meeting held on February 14, 2022.
- 2) The above is an extract of the detailed format of Financial Results for the quarter and nine months ended December 31, 2021 filed with the Stock Exchanges under the Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulation, 2015, as amended. The full format of the said 'Financial Results' are available on the website of Stock Exchange "www.bseindia.com." and on Company's website "www.winrocommercial.com." For and on behalf of the Board of Directors

Hetal Khalpada Date: February 14, 2022 Director Place : Mumbai DIN: 00055823

LANDMARK DALMIA GROUP

Landmark Property Development Company Limited

REGD. OFFICE: 11 TH FLOOR, NARAIN MANZIL, 23, BARAKHAMBA ROAD, NEW DELHI-110 001 Phone: (011) 43621200 FAX: (011) 41501333

CIN - L13100DL1976PLC188942 Email: info@landmarkproperty.in Website: www.landmarkproperty.in

	92 - 68		8	1.0	(Rs. In Lakhs
Particulars	Quarter ended 31/12/2021 (Unaudited)	Quarter ended 30/09/2021 (Unaudited)	Quarter ended 31/12/2020 (Unaudited)	Nine months ended 31/12/2021 (Unaudited)	Nine months ended 31/12/2020 (Unaudited)	Year Ended 31st March 2021 (Audited)
Total income	21.65	57.75	55.92	101.56	132.16	187.61
Net Profit / (Loss) for the period (before tax & Exceptional items)	11.68	12.02	15.82	36.05	39.82	53.35
Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	11.68	12.02	15.82	36.05	39.82	53.35
Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	8.71	9.12	11.36	27.15	29.41	40.08
Total Comprehevnsive Income for the period (comprising profit/(Loss) for the period (after tax and other Comprehensive income (after Tax)	8.71	9.12	11.36	27.15	29.41	40.12
Equity Share Capital	1,341.43	1,341.43	1,341.43	1,341.43	1,341.43	1,341.43
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)						4,861.66
Earning Per Share (Face Value of Re 1 each) (not annualised) Basic ;	0.01	0.01	0.01	0.02	0.02	0.03
Diluted :	0.01	0.01	0.01	0.02	0.02	0.03

Note: There were no exceptional items during the Quarter and Nine months ended 31st December, 2021.

accounting principal generally accepted in India)

The above is an extract of the detailed format of Quarterly/Nine Months ended Financial Results filed with the Stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) regulations, 2015, as amended. The full format of the Quarterly and nine month ended Financial Results is available on the stock exchanges websites www.nseindia.com and www.bseindia.com and on the company's website www.landmarkproperty.in

The above results for the Quarter/Nine month ended 31st December, 2021 has been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on February 14, 2022. The Statutory Auditors have expressed an unmodified opinion on the aforesaid results.

The financial results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) specified in the companies (Indian Accounting Standards), Rules 2015 (as amended) under section 133 of the Companies Act' 2013 (The

For Landmark Property Development Company Limited

Gaurav Dalmia Place : New Delhi Dated: 14th February, 2022 (Chairperson and Managing Director)



financialexp.epapr.in

Date: 14-02-2022

Place: Rajkot





